

ગુજરાત સરકાર
ઉદ્યોગ અને ખાણ વિભાગ
ઠરાવ ક્રમાંક:એસપીઓ/૧૦૨૦૧૫/૬૯૧૦૯૩/ચ
સચિવાલય, ગાંધીનગર.
તારીખ:૦૩/૦૬/૨૦૧૬.

વંચાણે લીધા:

- (૧) ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ ક્રમાંક:એસપીઓ/૧૦૯૫/૨૬૩૬/(૯૭)/ચ, તા: ૨૩/૦૯/૧૯૯૭
- (૨) નાણા વિભાગના પરિપત્ર ક્રમાંક:એસટીએ/૨૭૫૨/૧૧૭૩/ક, તા.૨/૫/૧૯૬૨
- (૩) નાણા વિભાગના પરિપત્ર ક્રમાંક:એસટી/૧૦૭૦/૬૨૪૬/ઠ, તા.૩૦/૧/૧૯૭૧
- (૪) ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ ક્રમાંક:એસપીઓ/૧૦૨૦૦૨/યુઓઆર/૨૪/ચ, તા:૨૮/૦૧/૨૦૦૩
- (૫) ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ ક્રમાંક: એસપીઓ/૧૦૨૦૦૨/યુઓઆર/૨૪/ચ, તા: ૨૧/૦૫/૨૦૦૩
- (૬) ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ ક્રમાંક:એસપીઓ/૧૦૨૦૦૫/૧૪૦૭/ચ, તા.૨૨/૧૧/૨૦૦૬
- (૭) ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ ક્રમાંક:એસપીઓ/૧૦૨૦૦૫/૧૪૦૫/ચ, તા.૮/૭/૨૦૧૧
- (૮) ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ ક્રમાંક: એસપીઓ/૧૦૨૦૦૨/યુઓઆર/૨૪/ચ, તા: ૨૭/૧૨/૨૦૧૧

પ્રસ્તાવના:

પ્રવર્તમાન ખરીદ નીતિ-૧૯૯૭ ઉપર વંચાણે લીધેલ ક્રમ(૧) સામેના તા.૨૩/૦૯/૧૯૯૭ના ઠરાવથી પ્રસિધ્ધ કરવામાં આવેલ. વર્તમાન પરિપ્રેક્ષ્યમાં સદરહું ખરીદ નીતિના અમલીકરણમાં અનુભવાતી મુશ્કેલીઓ, વિવિધ સંસ્થાઓ, ઉત્પાદક મંડળીઓ, મંડળો, બોર્ડ/નિગમો, ખરીદી કરતા અગ્રગણ્ય ખાતાઓ તથા સરકારના અન્ય ખાતાઓ તરફથી થતી રજૂઆતો, ભારત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ “MAKE IN INDIA” અભિયાન ઉપરાંત રાજ્યના અતિ નાના (સુક્ષ્મ), કુટિર તેમજ લઘુ ઔદ્યોગિક એકમો અને બેરોજગાર શિક્ષિતો તરફથી શરૂ કરવામાં આવેલ ઉદ્યોગોને તથા ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ સંલગ્ન સંસ્થાઓને બંન્નર સહાય આપવાની કામગીરી કરતા રાજ્યના નિગમો મારફત રાજ્યના લઘુ, કુટિર તેમજ નાના ઔદ્યોગિક એકમો વિગેરેને પૂરતી બંન્નર સહાય મળી રહે તે સમગ્ર બાબતો ધ્યાને લઈ ગુજરાત રાજ્ય ખરીદ નીતિ-૨૦૧૬ પ્રસિધ્ધ કરવાની બાબત સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી.

ઠરાવ:

પુખ્ત વિચારણાને અંતે, અતિ નાના (સુક્ષ્મ), કુટિર તેમજ લઘુ ઔદ્યોગિક એકમોને પ્રોત્સાહનરૂપે ખરીદ નીતિ-૧૯૯૭, તા.૨૩/૦૯/૧૯૯૭નો ઠરાવ અને તેમાં વખતો વખત બહાર પાડવામાં આવેલા સુધારા-વધારા અંગેના તમામ ઠરાવ/પરિપત્રો આથી રદ કરવામાં આવે છે અને રાજ્યમાં આવેલ અતિ નાના (સુક્ષ્મ), કુટિર અને લઘુ ઉદ્યોગો સહિતના ઔદ્યોગિક એકમો, શિક્ષિત બેરોજગારો તરફથી શરૂ કરવામાં આવેલ ઉદ્યોગો અને ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ સંચાલિત સંસ્થાઓ વિગેરેને પ્રોત્સાહનરૂપે તથા બંન્નર સહાયની

કામગીરી કરતા નિગમો મારફત પણ લઘુ તેમજ કુટિર ઉદ્યોગો વિગેરે સરકારી ખરીદીમાં સીધો જ ભાગ લઇ શકે અને સાથોસાથ રાજ્યના સરકારી વિભાગો, ખાતાઓ, કચેરીઓને વ્યાજબી અને સ્પર્ધાત્મક ભાવે ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ મળી રહે તે માટે નીચેની જોગવાઈઓને આધીન “ગુજરાત રાજ્ય ખરીદ નીતિ-૨૦૧૬” પ્રસિધ્ધ કરવામાં આવે છે.

(૧) મેક ઇન ઇન્ડીયા:

- (અ) ભારત સરકારના “MAKE IN INDIA” અભિયાન અંતર્ગત આ ખરીદ નીતિ હેઠળ ખરીદ કરવાની ચીજવસ્તુઓ ભારતમાં ઉત્પાદિત થયેલ હોવી જોઈએ. જરૂરિયાત મુજબની વસ્તુ એવી ટેકનિકલ સ્પેસીફિકેશનની હોય કે જે ભારતમાં ઉત્પાદિત થતી ના હોય અને વિદેશથી ખરીદ કરવી જરૂરી હોય તો તેવા ખાસ કિસ્સામાં સંબંધિત વિભાગના સચિવશ્રીનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.
- (બ) આયાતી ચીજવસ્તુઓ માટે ક્વોલીટી કાઉન્સિલ ઓફ ઇન્ડીયા (QCI) અથવા ભારતીય માનક બ્યુરો (Bureau of Indian Standard) અથવા ભારત સરકાર દ્વારા માન્ય સંસ્થાનું ગુણવત્તા પ્રમાણપત્ર (Quality Certificate) હોવું અનિવાર્ય છે.
- (ક) આ ખરીદ નીતિ હેઠળ રાષ્ટ્રીય ગુણવત્તા માનક/ગુણવત્તા પ્રમાણપત્ર/ક્વોલીટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (QCI), ભારતીય માનક બ્યુરો (BIS) અથવા ભારત સરકાર દ્વારા માન્ય સંસ્થાના માપદંડ મુજબની ગુણવત્તાવાળી ચીજવસ્તુઓની ખરીદીને પ્રાધાન્ય આપવાનું રહેશે અને આ અંગેની શરતનો ટેન્ડર ઈન્કવાયરીમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે.
- (ડ) વિદેશમાં ઉત્પાદિત ચીજવસ્તુઓ પૈકી કોઈ વસ્તુ માટે BIS અને ભારત સરકારની અન્ય સંસ્થાઓ સર્ટીફિકેટ આપતી ન હોય તેવા કિસ્સામાં આંતરરાષ્ટ્રીય માન્ય સંસ્થા પાસેથી અપાયેલ સર્ટીફિકેટ માન્ય ગણાશે.

(૨) પ્રાઈસ ટેન્ડર ફોર્મની કિંમત ચૂકવવામાંથી તથા અર્નેસ્ટ મની ડીપોઝીટ (ઈ.એમ.ડી.)

ભરવામાંથી મુક્તિ અંગેની શરતો:

- (અ) રાજ્યના અતિ નાના (સુક્ષ્મ), કુટિર તેમજ લઘુ ઔદ્યોગિક એકમો કે જે ટેન્ડર પ્રક્રિયામાં સીધે સીધા જ ભાગ લે અને ખરીદી હેઠળની ચીજવસ્તુઓના ઉત્પાદન માટેનો નોંધણી નંબર ધરાવતા હોય ઉપરાંત સી.એસ.પી.ઓ. અથવા રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ અથવા ડાયરેક્ટર જનરલ ઓફ સપ્લાઈઝ એન્ડ ડીસ્પોઝલ્સનો નોંધણી નંબર ધરાવતા હોય તેવા એકમો. (વિક્રેતા, એજન્ટ, ડીસ્ટ્રીબ્યુટર કે અન્ય મધ્યસ્થી મારફત સરકારી ખરીદીમાં પરોક્ષ રીતે ભાગ લે તો તેમને આ મુક્તિનો લાભ મળવાપાત્ર નથી).



- (બ) ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ માન્ય સંસ્થાઓ જે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી હોય, તેનું ખરીદી ગ્રામોદ્યોગ બોર્ડ, ખાદી અને વીલેજ ઈન્ડસ્ટ્રીઝ કમિશન (કે.વી.આઈ.સી.) અથવા કુટીર ઉદ્યોગનું નોંધણી પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
- (ક) રાજ્યનાં ઉત્પાદન પ્રવૃત્તિ કરતા નિગમોને ફક્ત ઉત્પાદન કરતી પોતાની જ ચીજવસ્તુઓ માટે જ ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ., ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિ., ગુજરાત રાજ્ય ઘેટાં અને ઉન વિકાસ નિગમ લિ. તથા ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા આ હેતુ માટે માન્ય કરવામાં આવેલ અને વખતો વખત માન્ય કરવામાં આવે તેવા, આ પ્રકારનાં અન્ય નિગમો.
- (ડ) પોતાનું ઉત્પાદન ન કરતા પરંતુ રાજ્યના અતિ નાના(સુક્ષ્મ), કુટિર તેમજ લઘુ ઔદ્યોગિક એકમો અને ગ્રામ્ય ઉદ્યોગ વિગેરે માટે બજાર સહાય પુરી પાડતા સરકાર દ્વારા માન્ય કરવામાં આવતા સરકારી નિગમો જેવા કે ગુજરાત ગ્રામોદ્યોગ (ગ્રીમકો) નિગમ લી. વિગેરે.
- (ઈ) રાજ્ય સરકાર/કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા માન્ય સંસ્થાઓ જેવી કે, અંધજન માટેની સંસ્થાઓ, બહેરા-મુંગા માટેની સંસ્થાઓ, અપંગો માટેની સંસ્થાઓ, માનસિક ક્ષતિવાળા બાળકો અને વ્યક્તિઓ માટેની સંસ્થાઓ, નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અથવા અન્ય સક્ષમ સત્તાઅધિકારી દ્વારા માન્યતા પ્રાપ્ત મહિલા સ્વસહાય જૂથ અને કુટીર ઉદ્યોગ કમિશનર દ્વારા માન્યતા પ્રાપ્ત ઉત્પાદક સમૂહો કે જેમણે સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રોમાંથી જે તે ચીજવસ્તુના ઉત્પાદન માટે નોંધણી પ્રમાણપત્ર મેળવેલ હોય અને જે સરકારી ખરીદીમાં સીધે સીધા ભાગ લે અને ચીજવસ્તુઓનું પોતે જ ઉત્પાદન કરતા હોવા જોઈએ.

ઉપરોક્ત એકમો સિવાયના ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેનાર એકમો માટે ટેન્ડર ફી તેમજ ઈ.એમ.ડી.ના દર નીચે મુજબના રહેશે.

ટેન્ડરની કુલ અંદાજિત રકમ	ટેન્ડર ફી રૂા.	ઈ.એમ.ડી.
રૂ.૨૫ લાખ સુધી	૧,૫૦૦	ટેન્ડરની કુલ અંદાજિત કિંમતના ત્રણ ટકા પ્રમાણે
રૂ.૨૫ લાખથી વધુ પરંતુ ૫૦ લાખ સુધી	૨,૫૦૦	
રૂ.૫૦ લાખથી વધુ પરંતુ એક કરોડ સુધી	૫,૦૦૦	
રૂ.૧ કરોડથી ઉપર	૧૫,૦૦૦	

નોંધ : ઈ.એમ.ડી. માન્યતા પ્રાપ્ત બેન્કના ડિમાન્ડ ડ્રાફ્ટ, પે ઓર્ડર, બેંક ગેરેન્ટી ચેકી કોઈપણ એક સ્વરૂપે સ્વીકારવાની રહેશે, ઈ.એમ.ડી. રોકડ સ્વરૂપે સ્વીકારવાની રહેશે નહીં. ઈ.એમ.ડી. અસફળ રહેલ બીડરોને પરત કરવાની થતી હોઈ, બેંક ખાતામાં જમા કરાવવી નહીં.

M. Soni

(૩) સીક્યોરીટી ડીપોઝીટ:

ટેન્ડર પ્રક્રિયામાં એલ-૧ બીડર (lowest bidder) પેઢી પાસેથી માલસામાનની ખરીદીની કિંમતના પાંચ ટકા લેખે સીક્યોરીટી ડીપોઝીટ લેવાની રહે છે, પરંતુ રાજ્યના અતિ નાના (સુક્ષ્મ), કુટિર અને લઘુ ઔદ્યોગિક એકમો જે ઉપરોક્ત પેરા (૨)માં દર્શાવેલ ભેગવાઈઓનું પાલન કરતા હોય તો તેઓને રૂપિયા પાંચ લાખ સુધીની ખરીદીમાં સીક્યોરીટી ડીપોઝીટ ભરવામાંથી મુક્તિ રહેશે, પરંતુ રૂપિયા પાંચ લાખથી વધુની ખરીદી હોય તેવા કિસ્સામાં સીક્યોરીટી ડીપોઝીટ પાંચ ટકાના સ્થાને ત્રણ ટકા લેખે ભરવાની રહેશે. તે સિવાયના અન્ય તમામ એકમોએ ખરીદીની કિંમતના પાંચ ટકા સીક્યોરીટી ડીપોઝીટ ભરવાની રહેશે.

એકમની કેટેગરી	રૂ. ૫ લાખ સુધીની ખરીદી	રૂ. ૫ લાખથી વધુની ખરીદી
ખરીદી નીતિ મુજબ ટેન્ડર ફી અને ઇ.એમ.ડી. ભરવામાંથી મુક્તિ મેળવતા હોય તેવા એકમો અથવા સંસ્થાને	મુક્તિ	૩%
તે સિવાયના અન્ય તમામ એકમો માટે	૫%	૫%

(૪) (અ) અતિ નાના (સુક્ષ્મ), કુટિર અને લઘુ ઔદ્યોગિક એકમોને ભાવ પસંદગી:

- 1 રાજ્યના કુટિર, અતિ નાના (સુક્ષ્મ) અને લઘુ એકમોને (The Micro, Small & Medium Enterprises Development Act-2006) રાજ્યના મધ્યમ તથા મોટા એકમો સામે તથા અન્ય રાજ્યના અતિ નાના (સુક્ષ્મ), કુટિર, લઘુ મધ્યમ તથા મોટા એકમો સામે ૧૦ ટકા ભાવ પસંદગીનો લાભ મળવાપાત્ર થશે.
- 2 રાજ્યના કુટિર, અતિ નાના (સુક્ષ્મ) અને લઘુ એકમ (The Micro, Small & Medium Enterprises Development Act-2006) પૈકીનું જે કોઈપણ ઉત્પાદિત એકમ મહિલા ધારક (મહિલા પ્રોપ્રાયટર) અથવા ભાગીદારી પેઢીના કિસ્સામાં તમામ ભાગીદાર મહિલા હોય અથવા કંપનીના કિસ્સામાં તમામ શેરધારક મહિલા હોય તેવા એકમોને રાજ્યના મધ્યમ તથા મોટા એકમો સામે તથા અન્ય રાજ્યના અતિ નાના (સુક્ષ્મ), કુટિર, લઘુ, મધ્યમ તથા મોટા એકમો સામે ૧૧ ટકા ભાવ પસંદગીનો લાભ મળવાપાત્ર થશે.
- 3 આ એકમોએ ટેન્ડર પ્રક્રિયામાં સીધે સીધો ભાગ લીધેલ હોય અને ખરીદી હેઠળની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા હોય અને સી.એસ.પી.ઓ. અથવા રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ અથવા ડાયરેક્ટર જનરલ ઓફ સપ્લાઈઝ એન્ડ ડીસ્પોઝલ્સનો નોંધણી નંબર મેળવેલ હોવો જરૂરી છે.



(બ) ગુણવત્તા આધારિત ભાવ પસંદગી:

ગુજરાત રાજ્યના અતિ સુક્ષ્મ, નાના અને કુટિર ઔદ્યોગિક એકમ કે જેણે સી.એસ.પી.ઓ. અથવા રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ અથવા ડાયરેક્ટર જનરલ ઓફ સપ્લાઇઝ એન્ડ ડીસ્પોઝિશનનો નોંધણી નંબર મેળવેલ તેવા એકમોના આઇ.એસ.આઇ./બી.આઇ.એસ./એગમાર્ક ધરાવતાં માલસામાન માટે ૫% વધુ ભાવ પસંદગી મળવાપાત્ર રહેશે, પરંતુ જે કિસ્સાઓમાં જે તે કાયદા કે નિયમો અન્વયે આવો માર્ક મેળવવાનું ફરજિયાત હોય તેવા કિસ્સાઓમાં આ લાભ મળવાપાત્ર થશે નહીં. આ જ પ્રમાણે જે કિસ્સાઓમાં આવા માર્ક ધરાવતી ચીજવસ્તુઓ માટે ભાવ મંગાવવામાં આવેલ હોય, તેવા કિસ્સાઓમાં પણ આ કારણસર વધારાના ૫% ભાવ પસંદગી મળવાપાત્ર રહેશે નહીં.

(પ) ઉક્ત ફકરા:(૪)માં દર્શાવેલ ભાવ પસંદગીના અર્થઘટન માટે નીચે મુજબની સ્પષ્ટતા ધ્યાને લેવાની રહેશે:

ભાવ-પસંદગીને પાત્ર રાજ્યના સૂક્ષ્મ/લઘુ/કુટિર ઉદ્યોગ એકમોએ તેમના ભાવ, L-1 ભાવ સમકક્ષ લાવવાના રહેશે. એજ રીતે મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા એકમોને આપવાની ભાવ પસંદગી તથા ગુણવત્તા આધારિત ભાવ-પસંદગીમાં પણ આ મુજબ કાર્યવાહી કરવાની રહેશે. એટલે કે, ગુણવત્તા આધારિત પાંચ ટકા ભાવ-પસંદગી ધ્યાનમાં લઈને કોઈપણ કિસ્સામાં પંદર ટકા કરતા વધારે ભાવ-પસંદગીનો લાભ મળવાપાત્ર થશે નહીં તેમજ ભાવ પસંદગીની જોગવાઈ અન્વયે વધુ કિંમત ચૂકવવી તેવું અર્થઘટન કરવાનું રહેશે નહીં, પરંતુ અન્ય રાજ્યના તમામ એકમો કે રાજ્યના મધ્યમ અથવા મોટા એકમ દ્વારા ઓફર કરવામાં આવેલ ભાવ પૈકી લઘુત્તમ ભાવ (L-1 ભાવ)થી દશ ટકા, અગિયાર ટકા કે પંદર ટકા (જે રીતે લાગુ પડતું હોય તે રીતે) સુધી વધુ ભાવની ઓફર કરેલ એકમોને ફક્ત ઓર્ડર આપવાની પ્રક્રિયામાં વિચારણામાં લેવાના રહેશે અને તેવા એકમો જો લઘુત્તમ ભાવ (L-1 ભાવ)થી માલ-સામાન પુરો પાડવા સંમત થાય તો તેમને L-1 ભાવથી ઓર્ડર આપવાનો રહેશે.

(૬) ભાવ મેળવણી (પ્રાઇસ મેર્ચીંગ):

(અ) સૌથી ઓછા ભાવ દર્શાવનાર L-1 એકમ અન્ય રાજ્યનું હોય તો રાજ્યના સૌથી ઓછા ભાવ દર્શાવનાર રાજ્યના અતિ નાના (સુક્ષ્મ), લઘુ, મધ્યમ અથવા મોટા ઔદ્યોગિક એકમોને ભાવ સરખામણી માટે વાટાઘાટો માટે બોલાવવા, ભાવ મેળવણી માટે નેટ પ્રાઇસ ગણતરીમાં લેવાની રહેશે. આવા કિસ્સાઓમાં સરખામણી માટેના પત્રકો ઉપર વંચાણે લીધેલ ક્રમ (૨) અને (૩) સામેના અનુક્રમે નાણાં વિભાગના પરિપત્ર ક્રમાંક:એસપીએ/૨૭૫૨/૧૧૭૩/ક, તા.૦૨/૦૫/૧૯૬૨ અને પરિપત્ર ક્રમાંક: જીએસટી/૧૦૭૦/૬૨૪૬/ઠ, તા.૩૦/૦૧/૧૯૭૧ની સૂચનાઓ મુજબ તૈયાર કરવાના રહેશે. (અનુક્રમે પરિશિષ્ટ-૬ અને પરિશિષ્ટ-૭)



- (બ) જો રાજ્યનું સૌથી ઓછા ભાવ દર્શાવનાર પ્રથમ એકમ અન્ય રાજ્યના સૌથી ઓછા ભાવ દર્શાવનાર એકમના ભાવ સાથે મેળવણી કરવા તથા તે મુજબની શરતો અને બોલીઓ માન્ય રાખવા સંમત થાય તો કુલ જથ્થાના ૫૦ ટકા ઓર્ડર રાજ્યના પ્રથમ સૌથી ઓછા ભાવ દર્શાવનાર ઔદ્યોગિક એકમને મળવાપાત્ર થશે.
- (ક) જો રાજ્યનું સૌથી ઓછા ભાવ દર્શાવનાર પ્રથમ એકમ ઉપર પેરા-૬(બ) મુજબ ભાવ મેળવણી માટે તૈયાર થાય નહીં તો આવા કિસ્સાઓમાં કુલ માંગના ૫૦ ટકા જથ્થાનો ઓર્ડર રાજ્યના સૌથી ઓછા ભાવ દર્શાવનાર બીજા એકમને અન્ય રાજ્યના સૌથી ઓછા ભાવ દર્શાવનાર એકમના ભાવપત્રકની શરતો અને બોલીઓ મુજબ મળવાપાત્ર થશે.
- (ડ) ઉપર પેરા-૬(બ) અને પેરા-૬(ક)માં દર્શાવ્યા મુજબ જો રાજ્યના એકમો કુલ માંગનો ૫૦ ટકા જથ્થો પુરો પાડી શકે તેમ ન હોય તેવા કિસ્સાઓમાં આ ૫૦ ટકા જથ્થાનો ઓર્ડર રાજ્યના સૌથી ઓછા ભાવ દર્શાવનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય એકમોને સરખા ભાગે અન્ય રાજ્યના સૌથી ઓછા ભાવ દર્શાવનાર એકમની શરતો અને બોલીઓને આધીન મળવાપાત્ર થશે.
- (ઈ) અતિ નાના (સુક્ષ્મ), કુટિર અને લઘુ એકમોને ભાવ મેળવણી કરવામાં અગ્રિમતા આપવાની રહેશે.

(૭) રાજ્યના અતિ નાના (સુક્ષ્મ), કુટીર અને લઘુ ઉદ્યોગો માટે આરક્ષણ:

- (અ) રાજ્યના અતિ નાના (સુક્ષ્મ), કુટિર અને લઘુ ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના આરક્ષણની યાદી આ ઠરાવ સાથેના પરિશિષ્ટ 'ક', 'ખ' અને 'ગ' મુજબ રહેશે.
- (બ) ભારત સરકારની ખરીદ નીતિમાં અતિ નાના અને લઘુ ઉદ્યોગો માટે ૩૫૮ ચીજવસ્તુઓ આરક્ષિત કરેલ છે, જેનો સમાવેશ આ ઠરાવ સાથેના પરિશિષ્ટ 'ક', 'ખ' અને 'ગ' માં કરવામાં આવેલ છે.

પરિશિષ્ટ-ક: સમગ્ર દેશના અતિ નાના (સુક્ષ્મ) અને લઘુ ઔદ્યોગિક એકમ માટે આરક્ષિત ૧૭૪ ચીજવસ્તુઓ

પરિશિષ્ટ-ખ: રાજ્યના અતિ નાના (સુક્ષ્મ) અને લઘુ ઔદ્યોગિક એકમો માટે આરક્ષિત ૧૮૮ ચીજવસ્તુઓ

પરિશિષ્ટ-ગ: રાજ્યના કુટીર ઉદ્યોગ માટે આરક્ષિત ૩૦ ચીજવસ્તુઓ

(૮) વિના ટેન્ડરે ખરીદી:

વિના ટેન્ડરે ખરીદી માટેનું વર્ગીકરણ નીચે મુજબ રહેશે.

કક્ષા: (ક) સરકારી સંસ્થાઓ

- (૧) જેલ
- (૨) ગુજરાત ગ્રામોદ્યોગ બજાર નિગમ લિ.(શ્રીમકો)
- (૩) ગુજરાત રાજ્ય વન વિકાસ લિ. (વનીલ ઉદ્યોગ)



- (૪) ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ.(ગુર્જરી)
- (૫) ગુજરાત રાજ્ય ઘેટા અને ઉન વિકાસ નિગમ લિ.(ગુશીલ)
- (૬) ગુજરાત ખેત ઉદ્યોગ નિગમ લિ.(નિગમ દ્વારા ઉત્પાદિત જંતુનાશક દવાઓ તથા અનાજ ભરવાના પીપ માટે જ)

નોંધ: આ સંસ્થાઓ દ્વારા જે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતું હોય અથવા જે ચીજવસ્તુઓના વેચાણ માટે માન્યતા મેળવેલ હોય તેવી જ ચીજવસ્તુઓની ખરીદી કરી શકાશે.

કક્ષા: (ખ) સરકાર માન્ય સંસ્થાઓ

- (૧) ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ/ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રીજ કમિશન લિ.(કેવીઆઇસી) દ્વારા માન્ય સંસ્થાઓ.
- (૨) અંધજન માટેની સંસ્થાઓ
- (૩) અપંગો માટેની સંસ્થાઓ
- (૪) માનસિક ક્ષતિવાળા બાળકો માટેની સંસ્થાઓ
- (૫) નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અથવા અન્ય સક્ષમ સત્તા અધિકારી દ્વારા માન્યતા પ્રાપ્ત મહિલા સ્વસહાય જૂથ
- (૬) રાજ્યના કુટીર ઉદ્યોગ કમિશનર દ્વારા માન્યતા પ્રાપ્ત ઉત્પાદિત સમૂહો

નોંધ: આ સંસ્થાઓ દ્વારા જે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતું હોય અથવા જે ચીજવસ્તુઓના વેચાણ માટે માન્યતા મેળવેલ હોય તેવી જ ચીજવસ્તુઓની ખરીદી કરી શકાશે.

(૯) નાણાંકીય મર્યાદા:

ઉપર પેરા-૮માં વર્ગીકૃત કરાયેલ સંસ્થાઓ/નિગમો પાસેથી નીચે દર્શાવેલ નાણાંકીય મર્યાદામાં જ વિના ટેન્ડર ખરીદી કરી શકાશે.

- (૧) કક્ષા:ક હેઠળ દર્શાવેલ સંસ્થાઓ દ્વારા જે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતું હોય અથવા જે ચીજવસ્તુઓના વેચાણ માટે માન્યતા મેળવેલ હોય તેવી જ ચીજવસ્તુઓની ખરીદી રૂ.૫,૦૦,૦૦૦ની મર્યાદામાં ભાવપત્રક(કવોટેશન) મેળવ્યા સિવાય કરી શકાશે.
- (૨) કક્ષા-ખ હેઠળ દર્શાવેલ સંસ્થાઓ દ્વારા જે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતું હોય અથવા જે ચીજવસ્તુઓના વેચાણ માટે માન્યતા મેળવેલ હોય તેવી જ ચીજવસ્તુઓની ખરીદી રૂ.૨,૦૦,૦૦૦ની મર્યાદામાં ભાવપત્રક (કવોટેશન) મેળવ્યા સિવાય કરી શકાશે. રૂ.૨,૦૦,૦૦૦ થી રૂ.૫,૦૦,૦૦૦ સુધીની ખરીદી ટચૂકડી જાહેર ખબર આપી કક્ષા-ખ હેઠળ દર્શાવેલ સંસ્થાઓ પાસેથી ખુલ્લા ટેન્ડર મેળવીને ખરીદી કરી શકાશે, પરંતુ આવા ટેન્ડર ત્રણ કરતા ઓછા હશે તો તે માન્ય ગણાશે નહીં.
- (૩) કક્ષા (ક) અને (ખ) હેઠળ દર્શાવેલ સંસ્થાઓ/નિગમો દ્વારા જે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતું હોય અથવા જે ચીજવસ્તુઓના વેચાણ માટે માન્યતા મેળવેલ હોય તેવી જ ચીજવસ્તુઓની વાર્ષિક રૂ.૫,૦૦,૦૦૦/-થી વધુ રકમની ખરીદી વર્તમાનપત્રોમાં વિગતવાર



જાહેરખબર આપીને કરી શકાશે અને આવી ખરીદી માટે વંચાણે લીધેલ ક્રમ(૬) અને ક્રમ(૭) સામેના ઉદ્યોગ અને ખાણ વિભાગના તા.૨૨/૧૧/૨૦૦૬ અને તા.૮/૭/૨૦૧૧ના ઠરાવો મુજબ ઇ-ટેન્ડરિંગ પદ્ધતિનો ફરજિયાતપણે અમલ કરવાનો રહેશે.

માન્ય સંસ્થાઓને માન્યતા આપતા આદેશોમાં જે આઈટમોનો ઉલ્લેખ થયેલ હોય તે આઈટમ પુરતી ઉપર દર્શાવેલ મર્યાદામાં વગર ટેન્ડરે ખરીદી થઈ શકશે. જે નિગમ/સંસ્થા માટે જે તે આઈટમ પૂરતો વિભાગ તરફથી ખાસ આદેશ આપવામાં આવેલ છે તે યથાવત રહેશે.

આ ખરીદીઓ અંદાજપત્રની જોગવાઈને આધીન કરવાની રહેશે.

(૧૦) આરક્ષણમાંથી મુક્તિ:

રાજ્યના અતિ નાના (સુક્ષ્મ), કુટિર અને લઘુ ઔદ્યોગિક એકમો માટે આરક્ષિત ચીજવસ્તુઓનો સમાવેશ પરિશિષ્ટ 'ક', 'ખ', અને 'ગ' માં કરવામાં આવેલ છે. પરંતુ આ કારણે સારી ગુણવત્તા ધરાવતા માલસામાનની ખરીદી કરવામાં અથવા યોગ્ય હરીફાઈ ન થવાના કારણે મુશ્કેલી જણાય અથવા અન્ય કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તેવા કિસ્સાઓમાં ખરીદકર્તા કચેરીએ આરક્ષણમાંથી મુક્તિ માટે સચિવશ્રીઓની ખરીદ સમિતિ(SPC)ની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે.

(૧૧) ભાવ કરાર:

(૧) ઉદ્યોગ કમિશનર અને મધ્યસ્થ સરંજામ ખરીદી અધિકારી (IC&CPO)ને વાર્ષિક ભાવ કરાર (Rate Contract)ની કામગીરી કરવા માટે આથી અધિકૃત કરવામાં આવેલ છે, આ સી.એસ.પી.ઓ.ના ભાવ કરાર હેઠળ સીધી ખરીદી કરવા માટે નીચે મુજબની મંજૂરીને આધીન ખરીદી કરી શકશે. સી.એસ.પી.ઓ.ના ભાવ કરાર અંગેની ટેન્ડર પ્રક્રિયામાં સ્પર્ધાત્મકતા થાય તેવા હેતુને ધ્યાને લેતાં ઇ.એમ.ડી.ની મહત્તમ મર્યાદા રૂ.દશ લાખ અને સીક્યોરીટી ડીપોઝીટની મહત્તમ મર્યાદા રૂ.વીશ લાખ રાખવાની રહેશે.

(અ) સરકારી કચેરીઓ:

અંદાજપત્રની જોગવાઈઓને આધીન ભાવ કરાર હેઠળ રૂપિયા એક લાખ સુધીની સીધી ખરીદી કરી શકાશે.

(બ) ખાતાના વડાની કચેરીઓ:

અંદાજપત્રની જોગવાઈઓને આધીન એક લાખથી વધુ અને એક કરોડ સુધીની સીધી ખરીદી કરી શકાશે.

(ક) વહીવટી વિભાગો:

અંદાજપત્રની જોગવાઈઓને આધીન એક કરોડથી વધુ અને પાંચ કરોડ સુધીની સીધી ખરીદી વિભાગની મંજૂરીથી કરી શકાશે.

(૬) રૂ.પાંચ કરોડથી વધુ કિંમતમાં આવતી ચીજવસ્તુની ખરીદી માટે સેક્ટરી પરચેઝ કમિટી (SPC)ની મંજૂરી લેવાની રહેશે.

- (૨) ભારત સરકારના DGS&D દ્વારા પણ વિવિધ ચીજવસ્તુઓના ભાવ કરાર કરવામાં આવે છે, DGS&Dના ભાવ કરાર હેઠળ રૂ.પાંચ લાખની મર્યાદામાં સીધી ખરીદી કરી શકાશે, પરંતુ રૂ.પાંચ લાખથી વધુ રકમની ખરીદી માટે પેરા-૧૩માં દર્શાવેલ ખરીદ સમિતિઓની મંજૂરી મેળવવાની રહેશે.
- (૩) ગુજરાત મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લીમિટેડ (GMSCL), ગુજરાત ઈન્ફોરમેટીક લીમિટેડ (GIL) દ્વારા પણ કેટલીક ચીજવસ્તુઓના ભાવ કરાર કરવામાં આવે છે. ગુજરાત મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લીમિટેડ (GMSCL), ગુજરાત ઈન્ફોરમેટીક લીમિટેડ(GIL)ના ભાવ કરાર મુજબ ખરીદી બજેટની જોગવાઈ અને નાણાકીય સત્તા સોંપણીની મર્યાદામાં વિના ટેન્ડરે કરી શકાશે. ગુજરાત મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લીમિટેડ (G.M.S.C.L), ગુજરાત ઈન્ફોરમેટીક લીમિટેડ(GIL)ના ભાવ કરાર અંગેની નીતિ જે તે વહીવટી વિભાગે પ્રસ્તુત ખરીદ નીતિને સુસંગત તૈયાર કરવાની રહેશે.

ભારત સરકારના DGS&D તથા ગુજરાત સરકારના CSPO, ગુજરાત મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ (GMSCL), અને ગુજરાત ઈન્ફોરમેટીક લીમિટેડ(GIL)ના ભાવ કરાર સિવાય અન્ય કોઈ ભાવ કરાર હેઠળ વિના ટેન્ડરની ખરીદી થઈ શકશે નહીં. દા.ત. ભાવ કરાર, રેટ કોન્ટ્રાક્ટ કે અન્ય કોઈ નામ હેઠળના કોન્ટ્રાક્ટ કે જે કેન્દ્રીય ભંડાર, નેશનલ કન્ઝયુમર કો-ઓપરેટીવ ફાઉન્ડેશન (NCCF) કે અન્ય કોઈ સંસ્થા દ્વારા કરવામાં આવેલ હોય તો તે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા માન્ય નથી અને તેઓ પાસેથી વિના ટેન્ડરે સીધી ખરીદી થઈ શકશે નહીં.

(૧૨) બ્રાન્ડેડ આઈટમની ખરીદી:

સામાન્ય રીતે કોઈ ચોક્કસ આઈટમ માટે એક જ ઉત્પાદક બજારમાં ઉપલબ્ધ હોય અને સદર ચોક્કસ આઈટમની વિશિષ્ટ જરૂરિયાત હોય તેવા કિસ્સામાં બ્રાન્ડેડ આઈટમની ખરીદી કરવી યોગ્ય રહે. અન્યથા સમાન સ્પેશીફિકેશન ધરાવતી બ્રાન્ડ વચ્ચે સ્પર્ધા થાય તેવું લીમિટેડ ટેન્ડર કરવું ઇચ્છનીય છે તેમજ બ્રાન્ડેડ ચીજવસ્તુઓની ખરીદી માટે સંબંધિત ખાતા/વિભાગના સચિવશ્રીનું ટેકનીકલ સ્પેશીફિકેશન અને ભાવના વ્યાજબીપણાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

નોંધ: બ્રાન્ડેડ ચીજવસ્તુઓની ખરીદી માટે નીચેની શરતો પરિપૂર્ણ થતી હોવી જોઈશે.

- (અ) બ્રાન્ડેડ ચીજવસ્તુઓની ખરીદવા માટે જે-તે વિભાગના સચિવશ્રી/અગ્રસચિવશ્રી/અધિક મુખ્ય સચિવશ્રીનું પ્રમાણપત્ર તથા બજેટ જોગવાઈ અને વહીવટી મંજૂરીની નકલ.
- (બ) બ્રાન્ડેડ ચીજવસ્તુઓ ખરીદી માટેની તાંત્રિક યથાર્થતા (ટેકનીકલ જસ્ટીફિકેશન રીપોર્ટ) તથા ખાતાના વડાની સ્પષ્ટ ભલામણ.
- (ક) બ્રાન્ડેડ ચીજવસ્તુઓની ખરીદીની શરતો અને સંબંધિત સાહિત્ય અને ભાવની યથાર્થતા અંગેની વિગત.



- (ડ) ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવેલ હોય તો ટેન્ડર ઇન્કવાયરીની વિગત અને કેસની ગુણવત્તા અનુસાર અન્ય સંબંધિત માહિતી.

(૧૩) ખરીદ સમિતિઓ અને તેની સત્તા મર્યાદાઓ:

(અ) ખરીદ નીતિના અમલીકરણ માટે નીચે મુજબની ખરીદ સમિતિઓ રહેશે.

(૧) ડીપાર્ટમેન્ટલ પરચેઝ કમિટી (DPC):

૧	ખાતાના વડા	અધ્યક્ષ
૨	નાયબ સચિવથી ઉતરતી કક્ષાના ન હોય તેવા, વહીવટી વિભાગના પ્રતિનિધિ	સભ્ય
૩	સિનિયર હિસાબી અધિકારી	સભ્ય
૪	વર્ગ-૧ થી ઉતરતી કક્ષાના ન હોય તેવા, મધ્યસ્થ સરંજામ ખરીદતંત્રના અધિકારી	સભ્ય
૫	વર્ગ-૧ થી ઉતરતી કક્ષાના ન હોય તેવા સિનિયર અધિકારી	સભ્ય સચિવ
૬	જરૂર હોય તો તકનિકી નિષ્ણાત	આમંત્રિત

(૨) સેક્ટરીએટ ડીપાર્ટમેન્ટલ પરચેઝ કમિટી (SDPC):

૧	સંબંધિત વિભાગના સચિવશ્રી/અગ્ર સચિવશ્રી/અધિક મુખ્ય સચિવશ્રી	અધ્યક્ષ
૨	સંબંધિત વિભાગના નાણાકિય સલાહકાર	સભ્ય
૩	નાયબ ઉદ્યોગ કમિશ્નર અથવા વર્ગ-૧ થી ઉતરતી કક્ષાના ન હોય તેવા, મધ્યસ્થ સરંજામ ખરીદતંત્રના પ્રતિનિધિ	સભ્ય
૪	સંયુક્ત સચિવશ્રી/નાયબ સચિવશ્રી અથવા ખાતાના વડા	સભ્ય સચિવ
૫	જરૂર હોય તો તકનિકી નિષ્ણાત	આમંત્રિત

(૩) સેક્ટરી પરચેઝ કમિટી (SPC):

૧	માંગ યાદી રજૂ કરનાર કચેરીના વહીવટી વિભાગના સચિવશ્રી/અગ્ર સચિવશ્રી/અધિક મુખ્ય સચિવશ્રી	
૨	ઉદ્યોગ અને ખાણ વિભાગના સચિવશ્રી/અગ્ર સચિવશ્રી/અધિક મુખ્ય સચિવશ્રી	
૩	સરકારના નાણા વિભાગના સચિવશ્રી/અગ્ર સચિવશ્રી/અધિક મુખ્ય સચિવશ્રી	
૪	સંબંધિત વિભાગની વિભાગીય ખરીદ સમિતિના વડા	
૫	અધિક ઉદ્યોગ કમિશ્નર (સ.ખ.), ઉદ્યોગ કમિશનરની કચેરી - સભ્ય સચિવ	
૬	જરૂર હોય તો તકનિકી નિષ્ણાત (આમંત્રિત)	



(બ) ખરીદ સમિતિની ખરીદીની મંજૂરી અંગેની નાણાકિય મર્યાદા નીચે મુજબ રહેશે.

(૧) ડીપાર્ટમેન્ટલ પરચેજ કમીટી (DPC):

ક્રમ	ખરીદીનો પ્રકાર	ખરીદીની મંજૂરી અંગેની નાણાકીય મર્યાદા
૧	સામાન્ય ખરીદી	રૂ. ૭૫,૦૦,૦૦૦/- સુધી
૨	સોલીટરી ઓફર	રૂ. ૧૦,૦૦,૦૦૦/- સુધી
૩	રિપીટ ઓર્ડર	રૂ. ૫,૦૦,૦૦૦/- સુધી
૪	તત્કાલ(ઇમરજન્સી) ખરીદી	રૂ.૧૦,૦૦,૦૦૦/- સુધી
૫	બ્રાન્ડેડ ખરીદી	સત્તા નથી

(૨) સેક્ટરીએટ ડીપાર્ટમેન્ટલ પરચેજ કમિટિ (SDPC):

ક્રમ	ખરીદીનો પ્રકાર	ખરીદીની મંજૂરી અંગેની નાણાકીય મર્યાદા
૧	સામાન્ય ખરીદી	રૂ.૭૫,૦૦,૦૦૦ થી વધુ અને રૂ.૫,૦૦,૦૦,૦૦૦ સુધી
૨	સોલીટરી ઓફર	રૂ.૧૦,૦૦,૦૦૦ થી વધુ અને રૂ.૫૦,૦૦,૦૦૦ સુધી
૩	રિપીટ ઓર્ડર	રૂ.૫,૦૦,૦૦૦ થી વધુ અને રૂ.૫૦,૦૦,૦૦૦ સુધી
૪	તત્કાલ(ઇમરજન્સી) ખરીદી	રૂ.૧૦,૦૦,૦૦૦થી વધુ અને રૂ.૩૦,૦૦,૦૦૦ સુધી
૫	બ્રાન્ડેડ ખરીદી	રૂ.૧૦,૦૦,૦૦૦ સુધી

(૩) સેક્ટરી પરચેજ કમિટી (SPC):

ક્રમ	ખરીદીનો પ્રકાર	ખરીદીની મંજૂરી અંગેની નાણાકીય મર્યાદા
૧	સામાન્ય ખરીદી	રૂ. ૫,૦૦,૦૦૦,૦૦/- થી વધુ
૨	સોલીટરી ઓફર	રૂ. ૫૦,૦૦,૦૦૦/- થી વધુ
૩	રિપીટ ઓર્ડર	રૂ. ૫૦,૦૦,૦૦૦/- થી વધુ
૪	તત્કાલ(ઇમરજન્સી) ખરીદી	રૂ, ૩૦,૦૦,૦૦૦/- થી વધુ
૫	બ્રાન્ડેડ ખરીદી	રૂ. ૧૦,૦૦,૦૦૦/- થી વધુ

ઉપર વંચાણે લીધેલ ક્રમ (૪), (૫) અને (૮) સામે દર્શાવેલ ઉદ્યોગ અને ખાણ વિભાગના તા.૨૮/૧/૨૦૦૩, તા.૨૧/૫/૨૦૦૩ અને તા.૨૭/૧૨/૨૦૧૧ના ઠરાવથી ખરીદ સમિતિઓની રચના અને આવી સમિતિઓને આપવામાં આવેલ નાણાકિય સત્તાઓ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે, તેમાં ઉપર મુજબ ફેરફાર કરવામાં આવે છે, પરંતુ સદરહુ ઠરાવની અન્ય શરતો અને ત્યારબાદ વખતોખવત બહાર પાડવામાં આવેલ સૂચનાઓ યથાવત રહેશે.



નોંધ:

- (I) સોલીટરી ઓફર: સોલીટરી ઓફર એટલે કે એક જ ટેન્ડર મળેલ હોય અને/અથવા તાંત્રિક ચકાસણીમાં માત્ર એક જ ટેન્ડર સ્વીકાર્ય રહેતું હોય તેવા કિસ્સામાં પણ બીડર પેઢીનું ફાયનાન્સીયલ બીડ ઓપન કરવાનું રહે છે. સોલીટરી ઓફર અથવા સ્પર્ધા મર્યાદિત થયેલ હોય તેવા કિસ્સામાં ખરીદી અંગેના આખરી નિર્ણય માટે ભાવના વાજબીપણાનો આધાર લેવાનો રહેશે. બીડર પેઢીઓ દ્વારા ઓફર કરવામાં આવેલ ભાવ સામે તે જ ચીજવસ્તુઓના બજારભાવ (માર્કેટસર્વે), ટેન્ડર પ્રસિધ્ધ કરનાર કચેરી-ઇન્ટેન્ટર કચેરીની છેલ્લી ખરીદીની વિગતો, બીડર પેઢી દ્વારા આ ચીજવસ્તુઓ કયા ભાવે સપ્લાય કરે છે તેની વિગત માટે સાયન્ટીફિક માર્કેટસર્વે કરી ભાવના વાજબીપણાનો અભિપ્રાય સાથે ખરીદી અંગેનો એજન્ડા જે તે સમિતિ સમક્ષ નિર્ણય અર્થે રજૂ કરવાનો રહેશે.
- (II) રિપીટ ઓર્ડર: ટેન્ડર પ્રક્રિયા અનુસર્યા સિવાય મૂળ ઓર્ડરની સામે બીડર પેઢી પાસેથી રીપીટ ઓર્ડર નીચેની શરતોને આધીન આપી શકાશે.
- (ક) મૂળ ઓર્ડરની તારીખથી છ માસની અંદર અથવા નાણાકીય વર્ષ પુરુ થાય તે પહેલાં અને માત્ર એક જ વખત રીપીટ ઓર્ડર આપી શકાશે, પરંતુ આવા દરેક પ્રસંગે સાથોસાથ જ નવા ટેન્ડર પ્રસિધ્ધ કરવાની કાર્યવાહી શરૂ કરવાની રહેશે.
- (ખ) ઓરીજનલ ટેન્ડર સ્વીકૃતિ પત્રથી ખરીદી માટે આપવામાં આવેલ ઓર્ડરના ૫૦% અથવા તેથી ઓછા જથ્થાની ખરીદી કરી શકાશે.
- (ગ) રીપીટ ઓર્ડર હેઠળ ચીજવસ્તુઓની ખરીદી કરનાર કચેરીએ મૂળ ઓર્ડર હેઠળ જે માલની ખરીદી કરેલ છે તે માલની પ્રવર્તમાન બજાર કિંમતમાં ઘટાડો થયેલ નથી તથા ટેકનોલોજી અપગ્રેડેશન થયેલ નથી તે બાબતનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
- (III) તત્કાલ (ઇમરજન્સી) ખરીદી:
- (ક) એકવીશ(૨૧) દિવસથી ઓછા દિવસ માટે ટેન્ડર પ્રસિધ્ધ થયેલ હોય તેવી ખરીદીને તત્કાલ (ઇમરજન્સી) ખરીદી ગણવાની રહેશે.
- (ખ) તત્કાલ ખરીદીના કિસ્સામાં ટેન્ડર પ્રસિધ્ધિનો સમયગાળો ઓછામાં ઓછો સાત દિવસનો હોવો જોઈશે.
- (ગ) તત્કાલ ખરીદીના કિસ્સામાં સંબંધિત વહીવટી વિભાગના સચિવશ્રીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ તત્કાલ ખરીદીની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
- (ઘ) અસાધારણ પ્રકારની તત્કાલ ખરીદી જેવી કે રોગચાળો, કુદરતી આપત્તિ, રમખાણો વગેરેના સંજોગોમાં ટેન્ડર પ્રસિધ્ધિનો સમયગાળો સાત દિવસથી ઓછો રાખવા માટે સંબંધિત વહીવટી વિભાગના સચિવશ્રી દ્વારા તત્કાલ ખરીદીના પ્રમાણપત્રમાં ખાસ સંજોગો અને ખરીદીની યથાર્થતા દર્શાવતા કારણોની નોંધ કરવાની રહેશે.



(૧૪) અમલીકરણ:

- (અ) આ નીતિનો અમલ રાજ્ય સરકારના વિભાગો, ખાતાના વડાઓ, કચેરીઓ, ઓથોરીટી, સરકારમાંથી ગ્રાન્ટ મેળવતા બોર્ડ/નિગમો સોસાયટીઓ વિગેરેએ ચૂસ્તપણે કરવાનો રહેશે.
- (બ) સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ પોતાની ખરીદ નીતિ, આ ખરીદ નીતિને સુસંગત તૈયાર કરવાની રહેશે.
- (ક) વંચાણે લીધેલ ક્રમ:૧ સામેના તા.૨૩/૯/૧૯૯૭ના ઠરાવ રદ થવા છતાં સદરહુ ઠરાવની ભેગવાઈને આધીન વિભાગ દ્વારા વિના ટેન્ડર ખરીદી માટે વ્યક્તિગત કિસ્સામાં આપવામાં આવેલ માન્યતા અંગેના હુકમો, તેવા હુકમોમાં દર્શાવેલ શરતોને આધીન, તેવા હુકમમાં દર્શાવેલ સમય-મર્યાદા સુધી અમલમાં રહેશે.
- (ડ) આ નીતિના અમલીકરણમાં થતાં ભંગ અંગે ઉદ્યોગ કમિશનર તરફથી ચકાસણી કરી તે અંગેનો અહેવાલ સરકારશ્રીના જે તે વહીવટી વિભાગને મોકલવામાં આવશે, અને સંબંધિત વહીવટી વિભાગે તેમના અભિપ્રાય સાથેનો અહેવાલ ઉદ્યોગ અને ખાણ વિભાગને મોકલવાનો રહેશે અને આ બાબતમાં ઉદ્યોગ અને ખાણ વિભાગનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા રહેશે.
- (ઘ) આ નીતિના અમલીકરણમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે અંગે ઉદ્યોગ અને ખાણ વિભાગનો પરામર્શ કરવાનો રહેશે અને ઉદ્યોગ અને ખાણ વિભાગનું અર્થઘટન અંતિમ અને બંધનકર્તા રહેશે.

આ ઠરાવ સમાન ક્રમાંકની ફાઇલ પરની નાણા વિભાગની તા.૯/૧૦/૨૦૧૫, ૨૨/૨/૨૦૧૬, ૨૬/૦૪/૨૦૧૬ અને તા.૧/૬/૨૦૧૬ની નોંધથી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,



(મહેન્દ્ર આર. સોની)

ઉપ સચિવ

ઉદ્યોગ અને ખાણ વિભાગ

પ્રતિ

1. *માન.રાજ્યપાલશ્રીના સચિવશ્રી, રાજભવન, ગાંધીનગર.
2. માન.મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી, ગુજરાત સરકાર, સચિવાલય, ગાંધીનગર
3. તમામ માન.મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રીઓ, ગુજરાત સરકાર, સચિવાલય, ગાંધીનગર
4. તમામ માન.રા.ક.મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રીઓ, ગુજરાત સરકાર, સચિવાલય, ગાંધીનગર
5. તમામ માન.સંસદીય સચિવશ્રીઓના અંગત સચિવશ્રીઓ, ગુજરાત સરકાર, સચિવાલય, ગાંધીનગર
6. માન.અધ્યક્ષશ્રી, કાર્યક્રમ અમલીકરણ સમિતિના અંગત સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર
7. માન.વિરોધપક્ષના નેતાશ્રીના અંગત સચિવશ્રી, ગુજરાત વિધાનસભા સચિવાલય, ગાંધીનગર



8. માન.મુખ્ય દંડકશ્રીના અંગત સચિવશ્રી, ગુજરાત વિધાનસભા સચિવાલય, ગાંધીનગર
9. અધિક મુખ્ય સચિવશ્રી, ઉદ્યોગ અને ખાણ વિભાગ, સચિવાલય ગાંધીનગર
10. અગ્ર સચિવશ્રી (પ્રવાસન), ઉદ્યોગ અને ખાણ વિભાગ, સચિવાલય ગાંધીનગર
11. સચિવશ્રી (કુટિર અને ગ્રામોદ્યોગ), ઉદ્યોગ અને ખાણ વિભાગ, સચિવાલય ગાંધીનગર
12. તમામ શાખાઓ/અધિકારીશ્રીઓ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર
13. નાણા વિભાગ, સચિવાલય, ગાંધીનગર
14. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર
15. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, સચિવાલય, ગાંધીનગર
16. ઉદ્યોગ કમિશનરશ્રી, ગુજરાત રાજ્ય, ઉદ્યોગ ભવન, ગાંધીનગર (૫૦૦ નકલો સાથે)
17. અધિક ઉદ્યોગ કમિશનરશ્રી(સ.ખ.), ઉદ્યોગ કમિશનરશ્રીની કચેરી, ઉદ્યોગ ભવન, ગાંધીનગર
18. સચિવાલયના તમામ વિભાગો... તેમના તાબા હેઠળના તમામ ખાતાના વડા/તાબાની/કચેરીઓ/બોર્ડ/કોર્પોરેશન/સંસ્થાઓ/સોસાયટીઓ/યુનિવર્સિટી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સહિત સંબંધિત સર્વેને જાણ કરવાની વિનંતી સહ..
19. ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળના તમામ ખાતાના વડા/બોર્ડ/કોર્પોરેશન/સંસ્થાઓ/સોસાયટી/યુનિવર્સિટી તરફ..તાબા હેઠળની કચેરીઓને જાણ કરવાની વિનંતી સહ, જાણ અને જરૂરી કાર્યવાહી સાફ.
20. સર્વે ખાતાના વડા/બોર્ડ/કોર્પોરેશન/સંસ્થાઓ/સોસાયટીઓ/યુનિવર્સિટીઓ.
21. એકાઉન્ટન્ટ જનરલ, અમદાવાદ/રાજકોટ
22. *સચિવશ્રી, ગુજરાત તકેદારી આયોગ, ગાંધીનગર
23. *સચિવશ્રી, ગુજરાત વિધાનસભા સચિવાલય, ગાંધીનગર
24. *રજીસ્ટ્રારશ્રી, ગુજરાત હાઈકોર્ટ, સોલા-અમદાવાદ
25. *રજીસ્ટ્રારશ્રી, ગુજરાત લોકાયુક્ત કચેરી, ગાંધીનગર
26. કમિશનરશ્રી, સરદાર પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લીક એડમીનીસ્ટ્રેશન (સ્પીપી),અમદાવાદ.
27. તમામ કલેક્ટરશ્રીઓ
28. તમામ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ
29. નિયામકશ્રી, હિસાબ અને તિબેરી, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર
30. હિસાબ અને તિબેરી અધિકારીશ્રીઓ
31. તમામ પેટા તિબેરી અધિકારીશ્રીઓ
32. તમામ મદદનીશ નિરીક્ષકશ્રીઓ (સ્થાનિક નિધિ હિસાબ)
33. પગાર અને હિસાબી અધિકારીશ્રી, અમદાવાદ, ગાંધીનગર, નર્મદા-ગાંધીનગર અને વડોદરા
34. સ્થાનિક ઓડિટ અધિકારી, અમદાવાદ-ગાંધીનગર
35. તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ
36. માહિતી નિયામકશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર.... જરૂરી પ્રેસ નોંધ પ્રસિધ્ધ કરવા સાફ.
37. કોમ્પ્યુટર સેલ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર..વિભાગની વેબ-સાઇટ ઉપર મૂકવાની વિનંતી સહ.
38. શાખા પસંદગી ફાઈલ.
39. નાયબ સેક્શન અધિકારી પસંદગી ફાઈલ.



ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ ક્રમાંક:એસપીઓ/૧૦૨૦૧૫/૬૯૧૦૯૩/ચ. તા.૦૩/૦૬/૨૦૧૬નું

પરિશિષ્ટ-ક

સમગ્ર દેશના અતિ નાના (સૂક્ષ્મ) અને લઘુ ઔદ્યોગિક એકમો માટે આરક્ષિત ૧૭૪ ચીજવસ્તુઓ

Sr.No	No. Mentioned in List of Govt. of India List (358)	Description of Item
1	8.	Augur (Carpenters)
2	9.	Automobile Head lights Assembly
3	15	Bath tubs
4	16	Battery Charger
5	17	Battery Eliminator
6	19	Belt leather & straps
7	20	Bench Vices
8	29	Boxes Leather
9	33	Brass Wire
10	38	Button of all types (except plastic)
11	39	Candle Wax Carriage
12	40	Cane Valves/stock valves (for water fittings only)
13	41	Cans metallic (for milk & measuring)
14	42	Canvas Products: (a) Water Proof Deliver, Bags to spec. No. IS - 1422/70 (b) Bonnet Covers & Radiators Muff. to spec. Drg.Lv7/NSN/IA/ 130295
15	43	Caps Cotton & Woollen
16	44	Caps Waterproof
17	47	Centrifugal steel plate blowers
18	48	Centrifugal Pumps suction & delivery 150 mm. x 150 mm
19	49	Chaff Cutter Blade
20	50	Chains lashing
21	52	Chamois Leather
22	53	Chokes for light fitting
23	54	Chrome Tanned leather (Semi-finished Buffalo & Cow)
24	55	Circlips
25	56	Claw Bars and Wires
26	60	Cloth Jaconet
27	61	Cloth Sponge
28	62	Coir fibre and Coir yarn
29	63	Coir mattress cushions and matting
30	64	Coir Rope hawserlaid



31	65	Community Radio Receivers
32	66	Conduit pipes
33	67	Copper nail
34	68	Copper Napthenate
35	69	Copper sulphate
36	70	Cord Twine Maker
37	71	Cordage Others
38	88	(a) Crucibles up to No. 200 (b) Crucibles Graphite up to No. 500 (c) Other Crucibles up to 30 kgs.
39	90	Curtains mosquito
40	91	Cutters
41	92	Dibutyl phthalate
42	94	Dimethyl Phthalate
43	97	Domestic Electric appliances as per BIS Specifications: Toaster Electric, Elect. Iron, Hot Plates, Elect. Mixer, Grinders Room heaters & convectors and ovens
44	102	Dust Shield leather
45	105	Electric Call bells/buzzers/door bells
46	106	Electric Soldering Iron
47	107	Electric Transmission Line Hardware items like steel cross bars, cross, arms clamps arching horn, brackets, etc
48	108	Electronic door bell
49	111	Equipment camouflage Bamboo support
50	112	Exhaust Muffler
51	113	Expanded Metal
52	114	Eyelets
53	115	Film Polythene - including wide width film
54	116	Film spools & cans
55	117	Fire Extinguisher (wall type)
56	118	Foot Powder
57	119	French polish
58	120	Funnels
59	121	Fuse Cut outs
60	122	Fuse Unit
61	124	Gas mantels
62	131	Grease Nipples & Grease guns
63	132	Gun cases
64	133	Gun Metal Bushes
65	134	Gumtape
66	136	Hand gloves of all types
67	137	Hand Lamps Railways
68	138	Hand numbering machine
69	139	Hand pounded Rice (polished and unpolished)

70	140	Hand presses
71	144	Harness Leather
72	145	Hasps & Staples
73	146	Haver Sacks
74	147	Helmet Non-Metallic
75	148	Hide and country leather of all types
76	149	Hinges
77	150	Hob nails
78	151	Holdall
79	153	Horse and Mule Shoes
80	156	Invalid wheeled chairs.
81	157	Invertor domestic type upto 5 kvA
82	159	Key board wooden
83	161	Kodali
84	162	Lace leather
85	163	Lamp holders
86	164	Lamp signal
87	165	Lanterns Posts & bodies
88	166	Lanyard
89	167	Latex foam sponge
90	168	Lathies
91	169	Letter Boxes
92	170	Lighting Arresters - upto 22 kv
93	171	Link Clip
94	172	Linseed Oil
95	173	Lint Plain
96	175	Lubricators
97	176	L.T. Porcelain KITKAT & Fuse Grips
98	177	Machine Screws
99	178	Magnesium Sulphate
100	179	Mallet Wooden
101	181	Measuring Tapes and Sticks
102	182	Metal clad switches (upto 30 Amps)
103	184	Metallic containers and drums other than N.E.C. (Not elsewhere classified)
104	185	Metric weights
105	186	Microscope for normal medical use
106	187	Miniature bulbs (for torches only)
107	188	M.S. Tie Bars
108	192	Nickel Sulphate
109	193	Nylon Stocking
110	194	Nylon Tapes and Laces
111	197	Pad locks of all types



112	199	Palma Rosa Oil
113	200	Palm gur
114	201	Pans Lavatory Flush
115	206	Piles fabric
116	207	Pillows
117	211	Playing Cards
118	215	Post Picket (Wooden)
119	216	Postal Lead seals
120	217	Potassium Nitrate
121	219	Pressure Die Casting upto 0.75 kg
122	220	Privy Pans
123	221	Pulley Wire
124	227	Railway Carriage light fittings
125	228	Rakes Ballast
126	232	Rivets of all types
127	236	Rubber Cord
128	239	Rubberized Garments Cap and Caps etc
129	240	Rust/Scale Removing composition
130	241	Safe meat & milk
131	242	Safety matches
132	243	Safety Pins(and other similar products like paper pins, staples pins etc)
133	244	Sanitary Plumbing fittings
134	245	Sanitary Towels
135	247	Scissors cutting (ordinary)
136	249	Sheep skin all types
137	250	Shellac
138	252	Shovels
139	254	Silk ribbon
140	255	Silk Webbing
141	256	Skiboats & shoes
142	258	Snapfastner (Excluding 4 pcs. ones)
143	260	Soap Curd
144	264	Soap Yellow
145	265	Socket/pipes
146	266	Sodium Nitrate
147	268	Sole leather
148	270	Spiked boot
149	271	Sports shoes made out of leather (for all Sports games)
150	273	Stapling machine
151	283	Stockinet
152	284	Stone and stone quarry rollers
153	288	Student Microscope



154	292	Tack Metallic
155	295	Teak fabricated round blocks
156	296	Tent Poles
157	297	Tentage Civil/Military & Salitah Jute for Tentage
158	301	Tin can unprinted up to 4 gallons capacity (other than can O.T.S.)
159	302	Tin Mess
160	303	Tip Boots
161	305	Toilet Rolls
162	306	Transformer type welding sets conforming to IS:1291/75 (upto 600 amps)
163	307	Transistor Radio up to 3 band
164	308	Transistorised Insulation - Testers
165	322	Water Proof paper
166	323	Water tanks up to 15,000 litres capacity
167	324	Wax sealing
168	325	Waxed paper
169	327	Welded Wiremesh
170	328	Wheel barrows
171	329	Whistle
172	331	Wind Shield Wipers (Arms & Blades only)
173	334	Wire nails and Horse shoe nails
174	336	Wood Wool

M. S. G. M.

પરિશિષ્ટ-ખ

રાજ્યના અતિ નાના (સૂક્ષ્મ) અને લઘુ ઔદ્યોગિક એકમો માટે આરક્ષિત ૧૮૮ ચીજવસ્તુઓ

Sr. No	No. Mentioned in List of Govt. of India List (358)	Description of Item
1	1	AAC(all aluminum conductor) and/or ACSR(aluminum conductor steel reinforced) Conductor up to 19 strands
2	2	Agricultural Implements, Bullock cart Axles (a) Hand Operated tools, (b) Animal driven implements
3	3	Air/Room Coolers
4	4	Aluminum hardware
5		Aluminum utensils
6		Aluminum Milk cans & measures
7	5	Ambulance stretcher
8	6	Ammeters/ohm meter/Volt meter (Electro magnetic upto Class I accuracy)
9	7	Anklets Web Khaki
10	10	Badges cloth embroidered and metals
11	12	Bandage cloth
12	13	Barbed Wire
13	14	Basket cane (Procurement can also be made from State Forest Corpn. and State Handicrafts Corporation)
14	18	Beam Scales (up to 1.5 tons)
15	21	Bituminous Paints
16	22	Blotting Paper
17	23	Bolts & Nuts
18	24	Bolts Sliding
19	25	Bone Meal
20	26	Boot Polish
21	27	Boots & Shoes of all types including canvas shoes
22	28	Bowls
23	30	Boxes made of metals
24	31	Braces
25	32	Brackets other than those used in Railways
26	34	Brief Cases (other than moulded luggage)
27	35	Brooms
28	36	Brushes of all types
29	37	Water Buckets

M. Soni

30	45	Castor Oil
31	46	Ceiling roses upto 15 amps
32	51	Chappals and sandals
33	57	Cleaning Powder
34	58	Clinical Thermometers
35	72	Corrugated Paper Board & Boxes
36	73	Cotton Absorbent
37	74	Cotton Belts
38	75	Cotton Carriers
39	76	Cotton Cases
40	77	Cotton Cord Twine
41	78	Cotton Hosiery
42	79	Cotton Packs
43	80	Cotton Pouches
44	81	Cotton Ropes
45	82	Cotton Singlets
46	83	Cotton Sling
47	84	Cotton Straps, Cotton string (waxed/Non waxed, Sewing-thread)
48	85	Cotton tapes and laces
49	86	Cotton Wool (Non absorbent)
50	87	Crates Wooden & plastic
51	89	Cumblies & blankets
52		Chain pulley block
53	257	Sluice valve
54		Clip Board
55		Conduit Pipes metallic
56		Cotton Garments, Clothes, Apparels & madeups
57		Cardboard boxes
58	93	Diesel engines up to 15 H.P
59	95	Disinfectant Fluids
60	96	Distribution Board up to 15 amps
61	99	Drawing & Mathematical Instruments
62	100	Drums & Barrels (For liquid storage)
63	101	Dust Bins(up to 10 ltr)
64	104	Dyes: (a) Azo Dyes (Direct & Acid), (b) Basic Dyes
65	109	Emergency Light (Rechargeable type)
66	110	Enamel Wares & Enamel Utensils
67		Electric motors up to 10 HP.
68	123	Garments (excluding supply from Indian Ordnance Factories)
69	125	Gauze cloth
70	126	Gauze surgical all types
71	127	Ghamellas (Tasllas)

M. S. Soni

72	128	Glass Ampules
73	129	Glass & Pressed Wares
74	130	Glue
75		Glue tapes all types
76	135	Hand drawn carts of all type
77	141	Hand Pump& its parts
78	142	Hand Tools of all types
79	143	Handles wooden and bamboo (Procurement can also be made from Gujarat State Forest Development Corporation and Gujarat Handloom and Handicrafts Development Corporation)
80	152	Honey
81	154	Hydraulic Jacks below 30 ton capacity
82	155	Dust(Powder) and liquid Sprayers for insecticides (Manual only)
83	158	Iron (dhobi)
84	160	Tool kit box made from Sheet metal (empty)
85	174	Lockers
86		LT Porceline insulator & fuse grips
87	180	Manhole covers
88		Metal Polish
89	189	Nail Cutters
90	190	Naphthalene Balls
91	191	Newar (plastic box strappings)
92	195	Oil Bound Distemper
93	196	Oil Stove & Wick Stove only
94	198	Paint remover
95	203	Paper Tapes (Gummed)
96		Paper weight
97	204	Papads
98	205	Pickles & Chutney
99	208	Plaster of Paris
100	209	Plastic Containers up to 20 liter excluding Poly Ethylene Terphthalate (PET) Containers
101	210	Plastic cane
102		Plastic Pen
103		Plastic Button
104	212	Plugs & Sockets electric up to 15 Amp
105	213	Polythene bags
106	214	Polythene Pipes
107	218	Pouches
108	222	PVC foot wears
109	223	PVC pipes up to 110 mm
110	224	PVC Insulated Aluminum Cables (up to 120 sq. mm) (ISS:694)



111	98	Domestic (House Wiring) P.V.C. Cables and Wires (Aluminum) Conforming to the prescribed BIS Specifications and up to 10.00 mm sq. nominal cross section
112		Polythene film, geometry compass, geometrical compass
113		Pencil
114	226	Rags
115	229	Razors
116	230	RCC Pipes up to 1200 mm. dia
117	231	RCC Poles Prestressed
118	233	Rolling Shutters
119	234	Roof light Fittings
120	235	Rubber Balloons
121	237	Rubber Hoses (Unbranded)
122	238	Rubber Tubing (Excluding braided tubing)
123	246	Scientific Laboratory glass wares (Barring sophisticated items)
124	248	Screws of all types including High Tensile
125	253	Sign Boards painted
126	259	Soap Carbolic
127	261	Soap Liquid
128	262	Soap Soft
129	263	Soap washing or laundry soap
130	267	Sodium Silicate
131		Spade Big Pedal
132	269	Spectacle frames
133	272	Squirrel Cage Induction Motors up to and including 100 KW440 volts 3 phase
134	274	Steel Almirah
135	275	Steel beds stead
136	276	Steel Chair
137	277	Steel desks
138	278	Steel racks/shelf
139	279	Steel stools
140	280	Steel trunks
141	281	Steel wool
142	282	Steel & aluminum windows and ventilators
143	286	Stranded Wire
144	287	Street light fittings
145		Stone ware Pipes
146	285	Stone ware Jars
147	289	Studs (excluding high tensile)
148	290	Surgical Gloves (Except Plastic)
149	291	Table knives (Excluding Cutlery)
150	293	Taps
151	294	Tarpaulins

M. S. Soni

152	298	Other Textiles products manufactured, N.E.C. (not elsewhere classified)
153	299	Tiles, (Cement & Ceramic tiles)
154	300	Tin Boxes for postage stamp
155	304	Toggle Switches
156	309	Trays, including metal tray
157	310	Trays for postal use
158	311	Un-motorized Trolley up to 50 Kg capacity
159	312	Trolleys - drinking water
160	313	Tubular Poles
161	314	Tyres & Tubes (Cycles)
162	315	Umbrellas
163	316	Utensils all types
164	317	Valves Metallic
165	318	Varnish Black Japan
166	319	Voltage Stabilisers including C.V.T's
167	320	Washers all types
168	321	Water Proof Covers
169	326	Weighing Scale
170	330	Wicks cotton
171	332	Wire brushes and Fiber Brushes, Wire adjusting screw
172	333	Wire Fencing & Fittings
173	335	Wire nettings of gauze thicker than 100 mesh size
174	337	Wooden ammunition boxes
175	338	Wooden Boards
176	339	Wooden Box for Stamps
177	340	Wooden Boxes and Cases N.E.C. (Not elsewhere classified)
178	341	Wooden Chairs
179		Wooden crates
180	342	Wooden Flush Door Shutters
181	343	Wooden packing cases all sizes
182	344	Wooden pins
183	345	Wooden plugs
184	346	Wooden shelves
185	347	Wooden veneers
186	348	Woollen hosiery
187	349	Zinc Sulphate
188	350	Zip Fasteners



પરિશિષ્ટ-ગ

રાજ્યના કુટીર ઉધોગ માટે આરક્ષિત ૩૦ ચીજવસ્તુઓ

Sr. No	No. mentioned in List of Govt. of India List (358)	Item Description
1.	11	Bags of all types i.e. made of leather, canvas & jute etc. including kit bags, mail bags, sleeping bags & water-proof bag
2.	59	Cloth Cover
3.	103	Cotton duster
4.	202	Paper conversion products, paper bags, envelopes, Ice-cream cup
5.	225	Cotton quilts, Razais
6.	251	Shoes laces
7.	351	Cane furniture
8.	352	Bamboo file tray, Baskets, Pencil stand, side racks etc.
9.	353	Artistic Wooden Furniture
10.	354	Wooden paper weight, racks etc.
11.	355	Glass covers made of wood and grass jute
12.	356	Jute furniture
13.	357	Jute bags, file cover
14.	358	Woolen & silk carpets
15.		Cotton cloth for packing
16.		Handloom Curtain Cloth
17.		Sofa durrie, Car seat durrie, Doormat
18.		Cotton cases
19.		Sponge of Cloth
20.		Purses, small bag of cotton cloth
21.		Cotton ropes
22.		Cotton twisted strings
23.		Coir Doormat, Bags, Purses
24.		Sankheda Furniture
25.		Cotton File Cover
26.		Broom
27.		Brush
28.		Candle
29.		Wooden vendor lorry (હાથભારી)
30.		Wooden boards



ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ ક્રમાંક:એસપીઓ/૧૦૨૦૧૫/૬૯૧૦૯૩/ચ. તા.૦૩/૦૬/૨૦૧૬નું

પરિશિષ્ટ-૬

*Supply of material to be purchased
By Government Departments/Offices-
Consideration of Quotation for-*

GOVERNMENT OF GUJARAT
Finance Department
Circular No.STA-2752/1173-K,
Sachivalaya, Ahmedabad,
Dated the 2nd May, 1962

CIRCULAR

A question regarding consideration of quotations from suppliers liable to pay tax, under the Sales Tax laws for supply of materials to be purchased by Government Department or Offices was under consideration of Government for Some time past. Government is now pleased to direct that in considering quotations from suppliers liable to pay sale tax/General Sales Tax to the Government of this State, the amount of tax so payable should be left out of accounts; while in the case of suppliers who have to pay Sales Tax under the local State Sales Tax law or the Central Sales Tax Act, 1956 to the Government of any other State, the amount of Such taxes should be considered. The comparative quotations computed on the above basis should then be considered on merits.

By order and in the name of the Government of Gujarat,

Sd/-
K.J.GHODA
Under Secretary to the Govt. of Gujarat
Finance Department

To,
All Secretariat Departments
All Heads of Departments/Offices
The Accountant General, Gujarat State, Ahmedabad.
The Accountant General, Rajkot.
The Pay and Account Officer, Ahmedabad.



ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ ક્રમાંક:એસપીઓ/૧૦૨૦૧૫/૬૯૧૦૯૩/ચ. તા.૦૩/૦૬/૨૦૧૬નું
પરિશિષ્ટ-૨

*Supply of material to be purchased
By Government Departments/Offices-
Consideration of Quotation for-*

GOVERNMENT OF GUJARAT
FINANCE DEPARTMENT
Circular No.GST 1070/6246-TH,
Sachivalaya, Gandhinagar
Dated the 30th January, 1971

Read: Government Circular, Finance Department No.STA-2752/1173-K,
Dated the 2nd May, 1962 (Reproduced Below)

CIRCULAR

Read: Government Circular, Finance Department No. Circular No.STA-2752/1173-K, Dated the 2nd May, 1962, Government has directed that While considering the quotations from suppliers who are liable to sales Tax/General Sales Tax, the amount of tax so payable should be left out of account; whereas in the case of suppliers who have to pay Sales Tax under the local Sales Tax law or the Central Sales Tax Act,1956 to the Government of any other State, the amount of Such taxes should be added to the gross price inclusive of tax considered. The comparative quotations computed on the above basis should then be considered on merits. It has come to the notice of Government that in spite of these instructions, some of the Government Departments/Offices do not follow the said instructions. It is therefore directed that the instructions and the procedures prescribed in the aforesaid circular in regard to consideration of quotations for supply of materials to be purchased by Government Departments/Offices should be observed scrupulously.

By order and in the name of the Government of Gujarat,

Sd/-

T.K.JAYARAMAN

Deputy Secretary to the Govt. of Gujarat.
Finance Department.

To,

1. All Secretariat Departments.
2. All Heads of Departments and Heads Office Under the Secretariat Departments/Offices.
3. All Finance Advisers
4. The Accountant General, Gujarat, Ahmedabad.
5. The Pay and Accountant Officer, Ahmedabad/Gandhinagar
6. All Branches in Finance Department
7. The Commissioner of Sales Tax, Ahmedabad (With 100 copies) (Distribution "A" Class)

રાજ્યના બોર્ડ/કોર્પોરેશન/સોસાયટીઓ/
કંપનીઓ/સંસ્થાઓ વિગેરે દ્વારા થતી
ખરીદી ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ
(જી.ઇ.એમ.) પોર્ટલ મારફત કરવા અંગે.

ગુજરાત સરકાર

ઉદ્યોગ અને ખાણ વિભાગ

ઠરાવ ક્રમાંક: એસપીઓ-૧૦૨૦૧૫-૬૯૧૦૯૩-(બો/કોર્પો.)-ચ

સચિવાલય, ગાંધીનગર.

તા.૧૪/૦૮/૨૦૧૭.

વંચાણે લીધા:-

- (૧) ડાયરેક્ટર જનરલ, ડી.જી.એસ.એન્ડ.ડી., મીનીસ્ટ્રી ઓફ કોમર્સનો તા.૭/૧૦/૨૦૧૬નો ડી.ઓ. પત્ર ક્રમાંક:૩૫૮૪/જીઇએમ/ડી.જી.એસ.એન્ડ.ડી./૨૦૧૬.
- (૨) સચિવશ્રી, મીનીસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ભારત સરકારનો તા.૭/૬/૨૦૧૭ નો ડી.ઓ. પત્ર ક્રમાંક: પ્રોક.રીફોર્મર્સ-૧૭-એમ.ઓ.યુ.-૨૦૧૭-આરએનએલ.

આમુખ:-

ભારત સરકારના નિર્દેશ અનુસાર ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ (જી.ઇ.એમ.) પોર્ટલની ડી.જી.એસ.એન્ડ.ડી. દ્વારા નેશનલ ઇ-ગવર્નન્સ ડીવીઝનની સહાયથી રચના કરવામાં આવેલ છે. ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ (જી.ઇ.એમ.) પોર્ટલ એ સરકારી ખરીદીઓ માટેનું સંપૂર્ણપણે ઓનલાઇન સેવા પૂરી પાડતું પોર્ટલ છે. પ્રસ્તુત પોર્ટલ શ્રેષ્ઠ કાર્યક્ષમતા તેમજ પારદર્શીતા પૂરી પાડે છે.

પ્રસ્તુત બાબતે ભારત સરકારના ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ (જી.ઇ.એમ.) પોર્ટલના ઉપયોગ માટે રાજ્ય સરકાર વતી ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ (જી.ઇ.એમ.), ભારત સરકાર સાથે તા.૧૧/૭/૨૦૧૭ના રોજ એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે.

ચીજવસ્તુઓ તેમજ સેવાઓ પૂરી પાડતા રાજ્યના સ્થાનિક વિકેતાઓના હિતમાં તેમજ આવા સ્થાનિક વિકેતાઓ પાસેથી જ વધુમાં વધુ સરકારી ખરીદી થઇ શકે તે હેતુને ધ્યાને લઇ રાજ્ય સરકારના તમામ વિભાગો, ખાતાના વડાની કચેરીઓ, ક્ષેત્રીય કચેરીઓ તેમજ બોર્ડ/કોર્પોરેશનો/ સોસાયટીઓ/સંસ્થાઓ ને રાજ્યના આવા વધુમાં વધુ સ્થાનિક વિકેતાઓ ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ (જી.ઇ.એમ.) પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવે તે માટે તેમને પ્રોત્સાહિત

કરવા તેમજ તેમના રજીસ્ટ્રેશનની કાર્યવાહી માટે જરૂરી તમામ પ્રયત્નો/સહાયતા કરવા જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે.

રાજ્ય સરકારના તમામ બોર્ડ/કોર્પોરેશન/સંસ્થાઓ/સોસાયટીઓ/મંડળીઓ/ કંપનીઓ દ્વારા તેમની જરૂરીયાત અનુસાર વિવિધ ખરીદીઓ કરવામાં આવે છે. રાજ્ય સરકારના વહીવટી વિભાગો તેમજ ખાતાના વડાની કચેરીઓ અને જીલ્લા તાલુકા કક્ષાની કચેરીઓ જેમ જ રાજ્યના આવા તમામ બોર્ડ/કોર્પોરેશન/સંસ્થાઓ/સોસાયટીઓ/મંડળીઓ/ કંપનીઓ પણ તેમના દ્વારા કરાતી ખરીદીઓ ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ (જી.ઇ.એમ.) પોર્ટલ મારફત કરે તે બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

ઠરાવ:-

આથી પુખ્ત વિચારણાના અંતે રાજ્ય સરકારના તમામ બોર્ડ/કોર્પોરેશન/ સંસ્થાઓ/સોસાયટીઓ/મંડળીઓ/કંપનીઓ દ્વારા તેમની જરૂરીયાત અનુસાર કરવામાં આવતી તમામ ખરીદીઓ અનિવાર્યપણે ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ (જી.ઇ.એમ.) પોર્ટલ મારફત જ નીચેની પ્રક્રિયા અનુસરીને કરવાનું આથી ઠરાવવામાં આવે છે.

➤ રજીસ્ટ્રેશન

Government e-Marketplace (GeM) ઉપર રજીસ્ટ્રેશન કરાવવા અંગે પૂર્વ જરૂરીયાત તરીકે રજીસ્ટ્રેશન કરાવનાર સંબંધિત તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રી દ્વારા અગાઉથી નેશનલ ઇન્ફોર્મેટીક સેન્ટર (NIC) પાસેથી પોતાના હોદ્દાને અનુરૂપ સરકારી ઇમેઇલ એડ્રેસ મેળવી લેવાનું રહેશે.

Government e-Marketplace (GeM) ઉપર સક્ષમ સત્તા ધરાવતા અધિકારીશ્રી સંબંધિત બોર્ડ/કોર્પોરેશન/સંસ્થા/સોસાયટી/મંડળી/કંપનીના વડાએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અથવા તેઓ આ માટે અન્ય સક્ષમ અધિકારીશ્રીની નિમણુક કરી શકશે. આ પ્રકારના રજીસ્ટ્રેશન ત્રણ તબક્કાના અધિકારી/કર્મચારીશ્રી દ્વારા કરવાના થશે. જેમાં,

- (૧) ખાતાના બોર્ડ/કોર્પોરેશન/સંસ્થા/સોસાયટી/મંડળી/કંપનીના વડા અથવા તેમના દ્વારા અધિકૃત મુખ્ય વહીવટી અધિકારી.
- (૨) મુખ્ય ખરીદકર્તા અધિકારીશ્રી
- (૩) હિસાબી અધિકારીશ્રી
- (૪) ખરીદકર્તા અધિકારીશ્રી(કન્સાઇની)નો સમાવેશ કરવાનો રહેશે.

➤ ખરીદવાની ચીજવસ્તુની પસંદગી

Government e-Marketplace (GeM) દ્વારા ખરીદવાની થતી ચીજવસ્તુની પસંદગી માટે તેના સ્પેશીફિકેશન નક્કી કરવા માટે જે-તે ખરીદકર્તા બોર્ડ/કોર્પોરેશન/સંસ્થા/સોસાયટી/મંડળી/કંપનીએ પોતાની આંતરીક કમિટી બનાવવાની રહેશે અને તેની નકલ તેઓના સંબંધિત વિભાગને, ઉદ્યોગ અને ખાણ વિભાગને તથા સી.એસ.પી.ઓ. કચેરીને આપવાની રહેશે. આવી કમિટી દ્વારા સ્પેશીફિકેશન તથા અન્ય તમામ બાબતો/શરતો નક્કી કરવાની રહેશે.

નાણાકીય ચુકવણી:-

સંબંધિત ખરીદકર્તા બોર્ડ/કોર્પોરેશન/સંસ્થા/સોસાયટી/મંડળી/કંપનીના વડા/ મુખ્ય વહીવટી અધિકારીએ ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ (જી.ઇ.એમ.) પોર્ટલના માધ્યમથી ખરીદી કરવાના સંજોગોમાં સપ્લાયરનું બીલનું ચુકવણી ચીજવસ્તુઓની ખરીદીની સ્વીકૃતિ (સી.આર.એ.સી.) જનરેટ થયા બાદ વધુમાં વધુ ૧૦ દિવસની અંદર કરવાની રહેશે.

ટેન્ડર/બીડ દસ્તાવેજ:-(ટેન્ડર/બીડ જરૂરી હોય તેવા સંજોગોમાં)

રાજ્ય સરકારની પ્રવર્તમાન ખરીદનીતિની વિવિધ જોગવાઈઓ ધ્યાને લઈ રાજ્યના ઉત્પાદકો, જુદીજુદી સરકારી તેમજ સરકાર માન્ય સંસ્થાઓ, રાજ્ય સરકારના ખરીદકર્તા વિભાગો, કચેરીઓ વગેરે ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ (જી.ઇ.એમ.) પોર્ટલના માધ્યમથી સરકારી ખરીદી કરે તે સંજોગોમાં સંભવિત કાયદાકીય તેમજ વહીવટીય પ્રશ્નો અને વેચનાર તેમજ ખરીદનાર વચ્ચેના વિવાદોને નિવારવા તેમજ અટકાવવા માટે ખરીદકર્તા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવનાર ટેન્ડર/બીડ દસ્તાવેજમાં ખુબ જ સ્પષ્ટતા સાથે જરૂરી જણાય તેવી તમામ શરતો અચૂક દર્શાવવાની રહેશે. ટેન્ડર બીડમાં ખરીદકર્તા કચેરી પોતાના ટેકનીકલ સ્પેસીફિકેશન તેમજ અન્ય શરતો ઉમેરી શકશે, પરંતુ આના લીધે સ્પર્ધા મર્યાદિત થવી જોઈએ નહીં.

ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ (જી.ઇ.એમ.) પોર્ટલ ઉપર ઉપલબ્ધ ન હોય તેવી ચીજવસ્તુઓની ખરીદીમાટે અનુસરવાની કાર્ય પદ્ધતિ:-

(૧) સૌપ્રથમ એવી ચીજવસ્તુઓ જે ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ (જી.ઇ.એમ.) પોર્ટલ પર ઉપલબ્ધ નથી તેની વિગતો સાથે જે પરચેઝ એપ્રુવલ કમિટિ સમક્ષ રજૂ કરી મંજૂરી મેળવ્યા બાદ ટેન્ડર કરી શકાશે.


(૨) આવી ચીજવસ્તુઓ ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ (જી.ઇ.એમ.) પોર્ટલ ઉપર ઉપલબ્ધ થાય તે સારૂ ઉદ્યોગ અને ખાણ વિભાગ મારફત ડી.જી.એસ. એન્ડ ડી. ને જાણ કરવાની રહેશે.

ન્યાયક્ષેત્ર:-

Government e-Marketplace (GeM) મારફતે થતી ખરીદી બાબતે ઉપસ્થિત થનાર કાયદાકીય તેમજ વહીવટી બાબતોનું ન્યાયક્ષેત્ર ખરીદકર્તા કચેરી જે સ્થળે હશે તે સ્થળ રહેશે. સપ્લાયર દ્વારા વેચાણ સંબંધિત બાબતો/વેચાણ પછીની સેવાઓ/ગેરંટી/વોરંટી વિગેરેનું પાલન ન થાય તેવા સંજોગોમાં ઉદ્યોગ અને ખાણ વિભાગનાં પરામર્શમાં, સપ્લાયર ઉપર યોગ્ય તે કાર્યવાહી બાબતે નિર્ણય કરશે. આ બાબતના અર્થઘટનમાં ઉદ્યોગ અને ખાણ વિભાગનો નિર્ણય આખરી રહેશે.

પ્રસ્તુત ઠરાવ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણા વિભાગની તા.૧૪/૮/૨૦૧૭ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,



(આનંદ બિહોલા)

નાયબ સચિવ

ઉદ્યોગ અને ખાણ વિભાગ

પ્રતિ,

- (૧) માન.રાજ્યપાલશ્રીના સચિવશ્રી, રાજભવન, ગાંધીનગર (પત્રથી)
- (૨) માન.મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી, માન.મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય.
- (૩) માન.નાયબ મુખ્યમંત્રીશ્રીના અંગત સચિવશ્રી.
- (૪) માન.કેબીનેટ મંત્રીશ્રીઓ (તમામ) ના અંગત સચિવશ્રીઓ.
- (૫) માન.રા.ક.મંત્રીશ્રીઓ (તમામ) ના અંગત સચિવશ્રીઓ.
- (૬) મુખ્ય સચિવશ્રીના અંગત સચિવશ્રી.
- (૭) સચિવાલયના સર્વે વિભાગો (સંબંધિત વિભાગ હેઠળના બોર્ડ/કોર્પોરેશન/સંસ્થા/ સોસાયટી/મંડળી/કંપનીને જાણ કરવાની વિનંતી સહ.)
- (૮) તમામ કલેક્ટરશ્રીઓ
- (૯) તમામ જીલ્લા વિકાસ અધિકારીશ્રીઓ.
- (૧૦) પસંદગી ફાઇલ.